



MEHTA INTEGRATED FINANCE LIMITED

CIN - L65910GJ1985PLC007692

Date: 04/11/2023

To,
BSE Limited
Corporate Relationship Department
PJ Towers,
Dalal Street,
Mumbai - 400 001

Scrip Code: 511377

Sub.- Board Meeting Notice –Publication of Advertisement in News Papers

Dear Sir/Madam,

In continuation of our Board Meeting notice dated 02.11.2023, a copy of the Board Meeting notice advertisement given in Free press Journal and Lokmitra (in English and Gujarati Edition) published on 03.11.2023 as per regulation 47 of the SEBI (LODR) Regulations, 2015 in respect of the Board Meeting scheduled to be held on 10.11.2023 for consideration and approval of Unaudited Financial Results for the Quarter and Half Year ended on 30.09.2023.

Please find enclosed the copy of the Board Meeting Notice advertisement published in English Edition (Free Press) an Regional Language (Gujarati Edition- Lok Mitra) for information and Record.

Kindly take the same on record.

Thanking You,

Yours faithfully,
For, **Mehta Integrated Finance Limited**



Kamleshbhai P. Patel
Company Secretary

Enclosure: A/a

Registered Office : 3, Law Garden Apt., Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380 006.
Tel. : 0091-79-26561000, Mobile: 9377578519 Email : mifl_in@yahoo.com,
Website : www.mehtaintegratedfinance.com

Union Finance Minister Smt. Nirmala Sitharaman inaugurates the first Global Conference on Cooperation in Enforcement Matters (GCCEM) in New Delhi

GCCEM will benefit world economy through networking and collaborative effort by the law enforcement agencies: Finance Minister

Union Minister for Finance and Corporate Affairs Smt. Nirmala Sitharaman presided over as Chief Guest at the inaugural session of the first ever three-day-long Global Conference on Cooperation in Enforcement Matters (GCCEM) in New Delhi. Union Minister of State for Finance Shri Pankaj Chaudhary was the Guest of Honour and Secretary General, World Customs Organisation, Dr. Kunio Mikuriya, was the Special Guest at the Inaugural Session. Shri Sanjay Kumar Agarwal, Chairman, CBIC, and members of the Board and other senior officers of the Department and various Law Enforcement Agencies / Organisations of India also graced the occasion. The genesis of GCCEM lay in the suggestion made by the Union Finance Minister at her last year's address at the Inaugural function of DRI Foundation Day in 2022, emphasising on the importance of greater cooperation and collaboration among international enforcement agencies for timely intelligence sharing and directed that in the year of India's 62nd Presidency, CBIC and DRI must hold an international conference towards this end. Against this backdrop, the Directorate of

Revenue Intelligence (DRI) under Central Board of Indirect Taxes and Customs (CBIC), in consultation with the World Customs Organisation (WCO), Brussels, is hosting the global conference from 30th October to 1st November 2023 with the theme 'It takes a Network to fight a Network'. The aim of the international conference is to facilitate sharing of insights, best practices and to serve as a catalyst for enhancing collaboration with Indian Customs' partner Administrations and for building new partnerships. The WCO has collaborated with Indian Customs to ensure wide participation by Member Administrations and international organisations, including WCO's Regional Intelligence Liaison Offices (RILOs) and senior representatives from the WCO Secretariat. Congratulating CBIC and DRI for ensuring the global conference sees the light of the day, Smt. Sitharaman stated that the global conference on enforcement matters is a major step forward in networking and collaborative efforts by the law enforcement agencies across the world, eventually benefiting not just India's economy but also the world economy. The Union Finance Minister observed that Customs has two important facets i.e. facilitation and enforcement. These should be at the core of functions of Customs and enforcement agencies. She suggested that officers must remain dedicated, make use of technology, share information and actionable intelligence with domestic and international agencies to create deterrence to illicit trade and Transnational Syndicates. The experience of agencies would show the direction and path to curb the evils in international trade. The Union Finance Minister also launched phase IV of 'Operation Sesh' by Indian Customs in collaboration with RILO Asia-Pacific and RILO Middle-East to curb the illegal trade of Timber including Red Sanders. Smt. Sitharaman stressed on curbing of illicit trade of red sanders with

emphasis on preserving other precious flora and fauna. Apart from above, the Union Finance Minister concluded by stating that international agencies should also cooperate in bringing back the antiquities to their respective countries. Smt. Sitharaman also acknowledged the role of World Customs Organisation in anchoring the sharing of knowledge between Customs enforcement agencies across the world and emphasised brainstorming into the requirement of further legislative and procedural in technology, including use of Artificial Intelligence. Shri Chaudhary emphasised that in the era of Artificial intelligence, the importance of intelligence sharing and increased collaboration amongst international agencies is more relevant. While addressing the gathering, Mr. Kunio Mikuriya, Secretary General, WCO, underlined the importance of sharing the knowledge amongst Customs agencies of all Countries besides the importance of transferring the knowledge to the next generations through mentoring.

MEHTA INTEGRATED FINANCE LIMITED
 CIN: L65910G1995PLC026062
 Regd. Off: 3, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006
 Phone No. 91-79-26561000 937758519
 Website: www.mehtaintegratedfinance.com Email: mifi_in@yahoo.com

NOTICE
 In terms of Regulation 29(1) read with Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, it is hereby notified that meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, 10th November, 2023 inter alia to consider and approve the Un-audited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2023 and to conduct any other business if any.
 The said notice may be accessed on the Company's website: www.mehtaintegratedfinance.com and may also be accessed on the website of Stock Exchange at www.bseindia.com.

For Mehta Integrated Finance Limited
Place: Ahmedabad **Sd/-**
Date: 02.11.2023 **Kamleshbhai P. Patel**
 Company Secretary

WESTERN RAILWAY-RAJKOT DIVISION
CONTRACT OF OPERATION & MAINTENANCE OF PAY & USE TOILET AND PREFABRICATED TOILET

File No. WR-RUTOCOM(EAR)/48/2022-O-0 SRI DCM/RJ/W/Tender Notice No. RUTPAYISE/17/Date: 27/10/2023; Office of the Sr. Divisional Commercial Manager, D.R.M. office, Kothi Compound, Rajkot - 380001; Tender Notice for E-Auction on IREPS for the Contract of Operation & Maintenance of Pay & Use Toilet and Prefabricated Toilet at Various Railway Station of Rajkot Division.

Sr. No.	Lot No.	Category	Description	Auction Date & Time
AA/1	PHU-RUT-OKHA-TO-22-3	(Pay and Use-Toilets)	Operation & Maintenance for Prefabricated Toilets/Urinals in circulating area of OKHA station	10.11.2023 11:00-11:30
AA/2	PHU-RUT-JAM-T0-22-3	(Pay and Use-Toilets)	Operation & Maintenance for Prefabricated Toilets/Urinals in circulating area of JAMNAGAR station	10.11.2023 11:00-11:40
AA/3	PHU-RUT-BKNG-TO-6-22-2	(Pay and Use-Toilets)	Operation & Maintenance for Prefabricated Toilets/Urinals in circulating area of BHAKTINAGAR station	10.11.2023 11:00-11:50
AA/4	PHU-RUT-SUNR-TO-7-22-2	(Pay and Use-Toilets)	Operation & Maintenance for Prefabricated Toilets/Urinals in circulating area of SURENDRANAGAR station	10.11.2023 11:00-12:00
AA/5	PHU-RUT-FATJ-TO-1-22-1	(Pay and Use-Toilets)	Operation & Maintenance for Normal Toilets/Urinals/Bathrooms or Sleeper Class Waiting room on Platform No. 1 at RAJKOT station	10.11.2023 11:00-12:10

For above all lot No. Category: Contract Period - 1096 Days **93**
 Like us on [Facebook](#) WesternRly / Follow us on [Twitter](#) / [WesternRly](#)

MEHTA SECURITIES LIMITED
 CIN: L6720G1994PLC022740
 Regd. Off: 2, Law Garden Apt. Scheme-1, Opp. Law Garden, Ellisbridge, Ahmedabad-380006
 Phone No. 91-79-26561000, 937758519
 Website: www.mehtasecurities.com Email: mehtasec@gmail.com

NOTICE
 In terms of Regulation 29(1) read with Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, it is hereby notified that meeting of the Board of Directors of the Company is scheduled to be held on Friday, 10th November, 2023 inter alia to consider and approve the Un-audited Financial Results for the Quarter and Half Year ended on 30th September, 2023 and to conduct any other business if any.
 The said notice may be accessed on the Company's website: www.mehtasecurities.com and may also be accessed on the website of Stock Exchange at www.bseindia.com.

For Mehta Securities Limited
Place: Ahmedabad **Sd/-**
Date: 02-11-2023 **Mahesh Motiwale**
 Company Secretary

PREMIER SYNTHETICS LIMITED
 CIN: L70100G1970PLC100829
 Reg. Office: Surana House, Behind Classic Chambers, Swastik X Rd, Opp. Naranaryan Complex, Navrangpura, Ahmedabad-380009, Gujarat.

The Meeting of the Board of Directors of the Company will be held on Friday, 10th November 2023 at the registered office of the Company at Surana House, Behind Classic Chambers, Swastik X Rd, Opp. Naranaryan Complex, Navrangpura, Ahmedabad-380009, inter alia, to consider & approve the Unaudited Financial Results for the Quarter ended 30th September, 2023 and to transact any other business with the permission of chairman. For further details please refer the web-link <http://www.premiersyntheticsltd.com/> & <https://www.bseindia.com/stock-share-price/premier-synthetics-ltd/premysyn/509835/>

For, Premier Synthetics Limited
Place: Ahmedabad **Sd/-**
Date: 02-11-2023 **Vismay Makwana**
 Company Secretary

CORIGENDUM
 Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B-2, 2nd Floor, Road No 1 Plot No- B3, WFI IT Park, Wagholi Industrial Estate, Thane, Maharashtra-400104

This is with reference to the captioned SARFAESI 13 (2) Notice dated May 31, 2017 (here in after referred to as 'said Notice') towards your aforementioned Home Loan Account No. LEVPI000206389. The Borrower SANTOSH S PANDE with ICICI Bank Ltd., we wish to mention that inadvertently and unintentionally Property Address & addressing an area of is mistakenly mentioned as LEVPI000206389. The correct address is: NR LOHA ENCLAVE BUNGLOW, OPP OSWAL CHHARWADA ROAD, S. No. 226/1/2 PAKI, VAPI - 396191. Addressing an area of 118.49 Sq.Mtrs. instead of FLAT NO 904, 9TH FLOOR SUNGITY TOWER, NR LOHA ENCLAVE BUNGLOW, OPP OSWAL CHHARWADA ROAD, S. No. 226/1/2 PAKI, VAPI - 396191. Adm. 118.49 Sq. Mtrs. i.e. 1275.00 Sq. Fts. of Super Built-up area along with Undivided Proportionate Share in Underneath Land Adm. 15.00 Sq. Mtrs. Therefore request you to please read re: FLAT NO 904, 9TH FLOOR SUNGITY TOWER, NR LOHA ENCLAVE BUNGLOW, OPP OSWAL CHHARWADA ROAD, S. No. 226/1/2 PAKI, VAPI - 396191. Adm. 118.49 Sq. Mtrs. i.e. 1275.00 Sq. Fts. of Super Built-up area along with Undivided Proportionate Share in Underneath Land Adm. 15.00 Sq. Mtrs.

All other details mentioned in the said SARFAESI 13(2) Notice will remain same. We sincerely regret the inconvenience caused to you in this regard.

Date: November 03, 2023 **Authorized Officer**
Place: Gujarat **ICICI Bank Limited**

MAS FINANCIAL SERVICES LIMITED
 Regd. Office: 6 Ground Floor, Narayan Chambers, B/H Patang Hotel, Ashram Road, Ahmedabad-380 009.
 Phone No.: +91 79 41106500, Fax No.: +91 79 41106597, E-mail: nidhi_bhayani@mas.com.in, Website: www.mas.co.in
 CIN: L65910G1995PLC026064

Extract of standalone and consolidated unaudited financial results for the quarter ended 30 September 2023 (Rs. in Crores)

Sr. No.	Particulars	Standalone			Consolidated		
		Quarter ended 30 September 2023 (UnAudited)	Quarter ended 30 September 2023 (UnAudited)	Year ended 30 September 2023 (Audited)	Quarter ended 30 September 2023 (UnAudited)	Quarter ended 30 September 2023 (UnAudited)	Year ended 31 March 2023 (Audited)
1	Total income from operations	295.82	229.51	946.09	310.37	240.80	987.83
2	Net profit / (loss) for the period (before tax, exceptional and / or extraordinary items)	80.02	65.00	264.70	82.51	68.26	271.65
3	Net profit / (loss) for the period before tax (after exceptional and / or extraordinary items)	80.02	65.00	264.70	82.51	68.26	271.65
4	Net profit / (loss) for the period after tax (after exceptional and / or extraordinary items)	60.01	48.75	200.96	61.94	51.20	205.82
5	Total comprehensive income for the period (comprising profit / (loss) for the period (after tax) and other comprehensive income (after tax))	57.19	32.91	181.51	59.01	35.56	187.40
6	Paid up equity share capital	54.66	54.66	54.66	54.66	54.66	54.66
7	Reserve (excluding revaluation reserve)	1,576.37	1,341.91	1,451.07	1,617.27	1,376.83	1,490.01
8	Securities Premium Account	426.87	426.87	426.87	426.95	426.95	426.95
9	Net worth	1,631.03	1,366.57	1,505.73	1,679.93	1,431.49	1,544.67
10	Paid up Debt Capital/Outstanding Debt	6,713.02	5,839.83	5,907.88	7,090.17	6,079.57	6,200.08
11	Outstanding Redeemable Preference Shares	-	-	-	-	-	-
12	Debt Equity Ratio (No. of times)	4.12	4.18	3.92	4.22	4.25	4.01
13	Earning per share (₹ - each) (for continuing and discontinued operations) - (not annualised for quarter)	10.98	8.92	36.76	11.19	9.18	37.18
14	Capital Redemption Reserve	Nil	Nil	Nil	NA	NA	NA
15	Debiture Redemption Reserve	Nil	Nil	Nil	NA	NA	NA
16	Debit Service Coverage Ratio	NA	NA	NA	NA	NA	NA
17	Interest Service Coverage Ratio	NA	NA	NA	NA	NA	NA

The above is an extract of the detailed format of unaudited financial results for the quarter and half year ended 30 September 2023 which have been reviewed by the Audit committee and subsequently approved by the Board of Directors in their meeting held on 1 November 2023, subjected to limited review / audit by the Statutory Auditors and filed with the Stock Exchanges under Regulation 33 and 52 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly / Annual Financial Results and pertinent disclosures related to other line items referred in the regulation 52 (4) of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, are available on the websites of the Stock Exchanges at www.bseindia.com, www.nseindia.com, and on the website of the Company at www.mas.com.in.

b) The unaudited financial results of the Company have been prepared in accordance with the recognition and measurement principles laid down in the Indian Accounting Standard (Ind AS) 34 'Interim Financial Reporting' prescribed under Section 133 of the Companies Act, 2013 (the 'Act') read with relevant rules issued thereunder and other accounting principles generally accepted in India and in compliance with Regulation 33 and Regulation 52 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended (the 'SEBI Listing Regulations'). Any application guidance/clarifications/directions issued by Reserve Bank of India ('RBI') or other regulators are implemented as and when they are issued/applicable.

For and on behalf of the Board of Directors of MAS Financial Services Limited
Place: Ahmedabad **Sd/-**
Date: 1 November 2023 **Kamlesh C. Gandhi**
 (Chairman & Managing Director)
 (DIN - 00044852)

WESTERN RAILWAY - AHMEDABAD SURVEY & CONSTRUCTION TENDER NOTICE

E-Tender No. Dy/CE-CV-VADI-DSL-NL/08 Date: 27/10/2023. By Chief Engineer(CV), Ahmedabad for & on behalf of President of Union of India invite E-tender for the following work : E-Tender No.: Dy/CE-CV-VADI-DL-NL/08, Name of Work: Construction of Lane Road Over Bridge with approaches and other Misc. works in lieu of Road Crossing No. 92 (KM 141.6) in connection with Bhaj-Naliya Gauge Conversion Project on Ahmedabad Division of Western Railway. Approx. cost of the work : ₹ 76,40,14,588.74, Bid Security : ₹ 39,80,100/-, Type of Tender : Two Packets (Technical and Financial). Website particulars Notice board location where complete details of the work to be done and press of the office : www.ireps.gov.in, Dy. Chief Engineer(CIV, Western Railway, Ahmedabad.

Like us on [Facebook](#) WesternRly

MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED
 Registered Office: 4th Floor, Narayan Chambers, Behind Patang Hotel, Ashram Road, Ahmedabad - 380 009

BRANCH CLOSURE NOTICE
 The borrowers in specific and the public in general are hereby notified that the branch office of the Company at Shop No. 107, Maple Crest, Near Sarkari Gin, Himmatnagar- Shyamalaji Highway, Himmatnagar is going to be closed after 3 months and the new branch address shall be Shop No. 105 & 106, Maple Crest, Near Sarkari Gin, Himmatnagar- Shyamalaji Highway, Himmatnagar 383001.

Further, the branch office of the Company at 74, 1st Floor, Shree Arcade Complex, Nr. Income Tax Office, Palanpur Abu H'way, Palanpur - 385001 is going to be closed after 3 months and the new branch address shall be 5-11-14, Shiv Plaza, Ahmedabad - Palanpur Highway, Palanpur 385001 is going to be closed within 3 months.

If the same are not closed after 3 months, a separate intimation shall be made. For more details kindly connect at 079 69274100 / manish_dave@mas.co.in

For, MAS RURAL HOUSING & MORTGAGE FINANCE LIMITED
Place: Ahmedabad **Sd/-**
Date: 03.11.2023 **AUTHORIZED OFFICER**

PHYSICAL POSSESSION NOTICE

ICICI Bank Branch Office: ICICI Bank Ltd., Office Number 201-B, 2nd Floor, Road No 1 Plot No-B3, WFI IT Park, Wagholi Industrial Estate, Thane, Maharashtra-400104

Whereas the undersigned being the Authorized Officer of ICICI Bank Limited under the Securitisation, Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) rules 2002, issued demand notices upon the borrowers mentioned below, to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of said notices. As the borrower failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules on the below-mentioned dates. The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of ICICI Bank Limited.

Sr. No.	Name of the Borrower/ Loan Account Number	Description of Physical Property/ Date of Physical Possession	Date of Demand Notice Issued in Demand Notice (Rs.)	Amount Due (Rs.)	Branch Name
1	Gaurav Sharma/ Sunitaben Sharma- LBAND00005771256	B 15 Rk Avenue Near Vaghasi Chokdins No.339	September 08, 2022	Rs. 36,28,558/-	Anand
2	Vyas Dhwan Ojas/ Vyas Ojas Bhartukumar- LBAND00005839100	Flat A/301, Kanha Sparsh, Behind Payal Complex, Xrs No.2384, Gujarat, Anand 388001-01, October 28, 2023	April 11, 2022	Rs. 24,32,723/-	Anand

The above-mentioned borrower(s)/guarantor(s) are hereby given a 30 day notice to repay the amount, else the mortgaged properties will be sold on the expiry of 30 days from the date of publication of this Notice, as per the provisions under Rules 8 and 9 of Security Interest (Enforcement) Rules 2002.

Date: November 03, 2023 **Authorized Officer**
Place: Anand **ICICI Bank Limited**

POPULAR ESTATE MANAGEMENT LIMITED
 CIN: L65910G1994PLC032387
 Registered Office: 81, 8th Floor "A" wing, New York Tower, Opp. Muktidham Derasar, Thaltej, S. G. Highway, Ahmedabad-380054, Gujarat
 E Mail: popularstatemanagement@yahoo.co.in Phone: 079-26858881

Part-I: Statement of Financial Results for the Quarter and Half-Year Ended on September 30, 2023 (Rs. in lakhs except per share data)

Sr. No.	Particulars	Quarter Ended		Six Month Ended		Year Ended
		30-09-2023 (Refer Note-5)	30-06-2023 (Un-Audited)	30-09-2023 (Refer Note-5)	30-06-2023 (Un-Audited)	
1	Revenue from Operations	-	-	-	-	-
2	Other Income	-	-	-	-	-
3	Total Income (1 + 2)	-	-	-	-	-
4	Expenses	-	-	-	-	-
(a)	Changes in Inventories of Finished Goods, Work-In-Progress and Stock-In-Trade	-	-	-	-	-
(b)	Employee Benefits Expenses	3.04	3.04	2.83	6.08	11.66
(c)	Finance Costs	-	-	0.27	-	1.33
(d)	Depreciation and Amortisation Expenses	4.22	5.34	6.83	9.56	15.54
(e)	Other Expenses	2.48	2.51	6.52	26.15	19.80
	Total Expenses (4)	9.74	30.89	16.45	41.80	42.18
5	Profit/(Loss) from Operations before Exceptional Items & Tax (3 - 4)	(9.74)	(30.89)	(16.45)	(41.80)	(42.18)
6	Exceptional Items	-	-	17.58	17.58	17.59
7	Profit / (Loss) from Ordinary Activities Before Tax (5 - 6)	(9.74)	(30.89)	(34.03)	(41.80)	(59.76)
8	Tax Expenses	-	-	-	-	-
(a)	Current Tax	-	-	-	-	-
(b)	Deferred Tax	-	-	3.25	(3.25)	(3.25)
9	Total Tax Expenses (8)	-	-	3.25	(3.25)	(3.25)
10	Net Profit/(Loss) for the period (7 - 8)	(9.74)	(30.89)	(37.28)	(38.55)	(56.51)
11	Other Comprehensive Income	-	-	-	-	-
12	Total Comprehensive Income for the period (9+10)	(9.74)	(30.89)	(37.28)	(38.55)	(56.51)
13	Paid-Up Equity Share Capital	1,400.02	1,400.02	1,400.02	1,400.02	1,400.02
14	Other Equity excluding revaluation reserve (Not Annualised)	-	-	-	-	-
(a)	Basic	(0.07)	(0.22)	(0.27)	(0.28)	(0.40)
(b)	Diluted	(0.07)	(0.22)	(0.27)	(0.28)	(0.40)

(See accompanying notes to the financial results)

Part-IV: Other Notes

1 The above results were reviewed by the Audit committee and subsequently approved and taken on record by the Board of Directors of the company at its meeting held on 26/10/2023. The statutory auditor of the company has carried out limited review of the above financial results.

2 **Contingent Liabilities** (Rs. in lakhs)

Particulars	As at 30-09-23	As at 31-03-23
Claim against the Company not acknowledged as debts under the provisions of Income Tax Act, 1961 and related rules	2,216.69	2,216.69

The above claim is subject to legal proceeding at various appellate authorities. The Company is contesting the above demand and the management including its tax advisors believes that its position will likely be upheld in the appellate process. The management believes that the ultimate outcome of these proceedings will not have a material adverse effect on the Company's financial position and results of operations.

3 The company is having substantial interest in two associated partnership firms. The company doesn't prepare consolidated financial statements by applying equity method of accounting under Indian Accounting Standard (Ind-AS) 28 'Investments in Associates and Joint Ventures' as there is no operations in the said partnership firms during the period covered by this financial results, and no profit / loss is attributable to the company.

4 The company operates only in one segment i.e. Infrastructure and hence there is no other primary reportable segment as required by Indian Accounting Standard (Ind AS) - 107 'Segment reporting'

5 The figures for the quarter ended September 30, 2023 and September 30, 2022 are balancing figures between the unaudited figures in respect of the respective half year and the unaudited published year to date figures upon first quarter ended June 30, 2023 and June 30, 2022 respectively, which were subject to limited review.

6 Previous Periods / Years' figures have been re-grouped / re-classified where necessary to make it comparable with the current period.

7 In view of uncertainty about sufficient future taxable income against which this Deferred Tax Asset/Liabilities can be realized, the same has not been recognised.

For and on behalf of the Board of Directors of Popular Estate Management Limited
Place: Ahmedabad **Sd/-**
Date: 26.10.2023 **VIKRAM C. PATEL**
 Manager, Director and CFO
 DIN: 00166707

